

B.Com. Semester - 6 (CBCS) Examination
April/May-2022 (NEW COURSE)
Corporate Tax Planning-2 (Dse-1 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ કામદારોનાં મહેનતાણાનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ ઉદાહરણ સાથે સમજાવો. (૨૦)
 અથવા
- પ્રશ્ન-૧ લિક્વિડેશનનાં સમયે મિલકતોનાં વિતરણનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ ઉદાહરણ સાથે સમજાવો.
- પ્રશ્ન-૨ વૈજ્ઞાનિક સંશોધન મિલકતોનાં વેચાણનાં સંદર્ભ સાથે ઉદાહરણ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો. (૨૦)
 અથવા
- પ્રશ્ન-૨ વીમા વળતરની રીસીપ્ટ સંદર્ભ સાથે ઉદાહરણ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો.
- પ્રશ્ન-૩ ફેરબદલી કિંમત નિર્ધારણ નિયમન જોગવાઈ વિશે સમજાવો. (૧૫)
 અથવા
- પ્રશ્ન-૩ સમજાવો: - ૧. એડવાન્સ પ્રાઇઝીંગ એગ્રીમેન્ટ
 ૨. ડબલ ટેક્સેશન રિલિફ
- પ્રશ્ન-૪ શાસક અને ગૌણ કમ્પનીઓ સાથે મિલકતોની ફેરબદલી વિશે સમજાવો. (૧૫)
 અથવા
- પ્રશ્ન-૪ સંયોજનનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો.

ENGLISH VERSION

- Que-1 Explain Corporate Tax Planning with Reference to Employees Remuneration with Example. (20)
 OR
- Que-1 Explain Corporate Tax Planning with Reference to distribution of assets at the time of Liquidation with Example.
- Que-2 Explain Corporate Tax Planning with Reference to sale of Scientific Research assets with Example. (20)
 OR
- Que-2 Explain Corporate Tax Planning with Reference to Receipt of Insurance compensation with example.
- Que-3 Explain about provisions Regulating Transfer pricing. (15)
 OR
- Que-3 Explain: -
 1. Advance pricing Agreement
 2. Double Taxation Relief
- Que-4 Explain about Transfer of assets between holding and subsidiary companies. (15)
 OR
- Que-4 Explain Corporate Tax planning with Reference of Amalgamation.
